\Delta केनरा बैंक Canara Bank

Canara Bank Regional Office: VIII Floor, Western Business Park Udhna - Magdalla Road, Vesu, Surat, Gujarat 395007. Bardoli Baranch

Demand Notice (Section 13(2) to Borrower / Guarantor / Mortgagor To, GHANSHYAMBHAI RAMJIBHAI LIMBASIYA

io, granofitamidhai ramaidhai Limbatta Address 1 : V - B Mahlacami Society Punagam,plot no-242 f f Punagam Simada ,surat. Contact- 9879145268. Pin Code -395005 ADDRESS 2: Plot No. 262/G, Block no 146/A/262, ROYAL Residency, Tal:Palsana, Surat VINUBHAI JIVARAJBHAI LIMBASIYA

3-242 MAHALAXMI SOCIETY VI-2, PUNA 122, TAL-CHORYASI, SURAT,GUJRAT- 394211

Sub: NOTICE issued under section 13(2) of the Securitization and Reconstruction o Financial Assets and Enforcement of Security Interest Act 2002.

The undersigned being the Authorized Officer of Canara Bank BARDOLI branch (hereinafter

referred to as "the secured creditor"), appointed under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, (hereinafter referred as the "Act") do hereby issue this notice to you as under:
That Sri. GHANSHYAMBHAI RAMJIBHAI LIMBASIYA (hereinafter referred to as "the

Borrower") has availed credit facility / facilities stated in the **Schedule A** hereunder and have entered into the security agreement/s in favour of the secured creditor. While availing the said financial assistance, you have expressly undertaken to repay the loan amount/s in accordance with the terms and conditions of the above mentioned agreements.

That VINUBHAI JIVARAJBHAI LIMBASIYA (hereinafter referred to as "the Guarantor") has guaranteed the payment on demand of all moneys and discharge all obligations and liabilities owing or incurred to the secured creditor by the Borrower for credit facilities (**Fund** based / Non Fund Based) up to the limit of Rs 14,04,000/- with interest thereon .

You are also entered in to agreements against the secured assets which are detailed in

However, from **DEC 2023**, the operation and conduct of the said financial assistance / credit acilities have become irregular. The books of account maintained by the secured ass shows that the liability of the Borrower towards the secured creditor as on 14.03.2024 mounts to Rs. 15,93,077.23 (Rupees Fifteen Lacs Nighty Three Thousand Seventy Seven & paise Twenty Three Only), + further Interest and charges thereon, the details of which together with future interest rate are stated in Schedule C hereunder. It is further stated that the Borrower/Guarantor having failed to keep up with the terms of the above said agreement in clearing the dues of the secured creditor within the time given, and have been evasive in settling the dues. The operation and conduct of the above said financial assistance / credit facility/ies having come to a standstill and as a consequence of the default committed in repayment of principal debt/ instalment and interest thereon, the secured creditor was constrained to classify the debt as Non-Performing Asset (NPA) as on 14.03.2024 in accordance with the directives/guidelines relating to asset classification issued by the Reserve Bank of India.The secured creditor through this notice brings to you attention that the Borrower has failed and neglected to repay the said dues/ outstanding liabilities and hence hereby demand you under Section 13(2) of the Act, by issuing this notice to discharge in full the liabilities of the Borrower as stated in **Schedule C** hereunder to the secured creditor within 60 days from the date of receipt of this notice. Further, it is brought to your notice that you are also liable to pay future interest at the rate of mentioned in schedule C together with all costs, charges, expenses and incidental expenses with respec to the proceedings undertaken by the secured creditor in recovering its dues.

Please take note of the fact that if you fail to repay to the secured creditor the aforesaid sum of Rs. 15,93,077.23 (Rupees Fifteen Lacs Nighty Three Thousand Seventy Seven & paise Twenty Three Only), together with further interest (as stated in schedule C) and ncidental expenses and costs as stated above in terms of this notice under Section 13(2) of the Act, the secured creditor will exercise all or any of the rights detailed under sub-sectio (4)(a) and (b) of Section 13, the extract of which is given here below to convey the riousness of this issue:

13(4)- In case the Borrower/Guarantor fails to discharge liability in full within the period specified in sub-section (2), the secured creditor may take recourse to one or more of the following measures to recover his secured debt, namely;

a) Take possession of the secured assets of the Borrower/Guarantor including the right to transfer by way of lease, assignment or sale for realizing the secured asset;
(b) Take over the management of the business of the Borrower including the right to transfe

by way of lease, assignment or sale for realizing the secured asset:

Provided that the right to transfer by way of lease, assignment or sale shall be exercised only where the substantial part of the business of the Borrower is held as security for the debt; Provided further that where the management of whole of the business or part of the business is severable, the secured creditor shall take over the management of such business of the borrower which is relatable to the security for the debt and under other applicable provisions of the said Act. Your attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

You are also put on notice that in terms of Section 13 (13) the Borrower/Guarantor shall not transfer by way of sale, lease or otherwise the said secured assets detailed ir Schedule B hereunder without obtaining written consent of the secured creditor. It is further brought to your notice that any contravention of this statutory injunction/ restraint, as provided under the said Act, is an offence and if for any reason, the secured assets are sold or leased out in the ordinary course of business, the sale proceeds or income realized shall be deposited with the secured creditor. In this regard you shall have to render prope accounts of such realization / income.

This notice of Demand is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which the secured creditor may have including further demands for the sums found due and payable by you. This is without prejudice to any other rights available to the secured creditor under the Act and/or any other law in force. Please comply with the demand under this notice and avoid all unpleasantness. In case of Non compliance, further needful action will be resorted to, holding you liable for all costs and

consequence.						
Details of the credit facility/ies availed by you : SCHEDULE - A						
S	SI Loan No. 1 3430619000068		Nature of Loan / Limit Date of Sanction		Amount (Rs)	
1			Housing Loan	25/10/2015	12,84,000/-	
2	2 3430629000081		HOME LOAN PLUS	15/06/2021	1,20,000/-	
Details of Security Assets : SCHEDULE - B						
SI No Description		Descripti	on. Name of the title hole		holder	

	1 Hypothecation	NA						
De	Details of Immovable Assets							
SI	Nature	Name of the title holder						
1	All that piece and parcel of the immovable proper Plot No. 262 admeasuring area 66.92 sq. Mtrs common rights, construction made or to be miand undivided proportionate share in COP at "Royal Residency situated on the land bearing Ne: 146/A (Block No. 146, 146/A, 147, 148, 149, R 130, 131/1+131/1, 132, 133); of village: Soya Palsana, District: Surat. Having boundaries Bounded: On the North by: Plot no 263, On the Sc. no. 261, On the East by: Plot no 255, On the	i. Alongwith ade thereon ind Road of Boad of sw Block No .S. No. 129, ini, Taluka:-as under: buth by: Plot						

╙	occord internal						
[Details of liability as on date] SCHEDULE – C							
SI	Loan No. Nature of as		Principal as on date 14/03/2024	Interest and other charges as on date date 14/03/2024	Total Liability as on date 14/03/2024	Rate of Interest	
1	3430619000 068	Housing Loan	15,24,154.72	35,515.86	15,59,670.58	9.00+ 2.0 i.e 11.00%	
2	3430629000 081	HOME LOAN PLUS	32,367.65	1039.00	33,406.65	11.20+ 2.00 i.e13.20%	
		Total			15,93,077.23		
Da	Date : 18/03/2024 Place : Bardoli Authorised Officer, Canara Bank						

Road, Chikhli, Navsari-396521. Gujarat, Phone- +91 02634-232336, E-mail chikhl@bankofbaroda.com Bank of Baroda

APPENDIX IV [See Rule 8(I)] POSSESSION NOTICE

Whereas. We, the undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Securify Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13(12) read with (Rule-8) the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice date **09.01.2024** calling upon the Borrowers / Mortgagor Mrs. Swatiben Anilbhai Thaku and Mr. Prashad Anil Thakore to repay the amount mentioned in the notice being Rs 16,21,837.46 (Rupes Sixteen Lac Twenty One Thousand Eight Hundred Thirty Seven and Paisa Forty Six Only) as on 08.01.2024 (inclusive of interest up to 31.12.2023) and further interest thereon and other charges and expenses within 60 days The Borrowers / Mortgagor having failed to repay the amount, notice is hereby given to

the Borrowers / Mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred or him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on thi

28th day of March of the year 2024.

The Borrowers / Mortgagor in particular and the public in general is hereby cautioned no The Borrowers/ Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda for an amount of Rs. 16,21,837.46 (Rupees Sixteen Lac Twenty One Thousand Eight Hundred Thirty Seven and Paisa Forty Six Only) as on 08.01.2024 (inclusive of interest up to 31.12.2023) and further interest thereon and other charges and expenses until full payment.

The borrower's attention is invited to provision of sub section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the immovable property

All the piece and parcel of House bearing Plot No. 9/E (Navsari-Vijalpore Municipal House No. 1856/0), admeasuring 42.93 sq. mtrs. and construction thereon admeasuring 35.78 sq. mtrs. on land bearing Revenue Survey No. 131/2/Paiki 2, revised Block No. 6091 admeasuring 3760 sq. mtrs. of Ward No. 11 of Navsari-Vijalpore Municipal Corporation, Reva Nagar, Vijalpore, Taluka and District Navsari-standing in the name of Mrs. Swatiben Anilbhai Thakur and bounded as follows: East: Plot No. 9/F; West: Plot No. 10/A; North: Contiguous Survey No. land; South: Road.


Date: 28.03.2024 | Place: Navsari

Chief Manager & Authorised Officer

Aadhar Housing Finance Ltd.

Corporate Office: Unit No. 802, Natraj Rustomjee, Western Express Highway and M.V. Road, Andheri (East), Mumbai - 400069,

Rajkot 3 Branch: Bearing No. Block 2 at Nakshatra - 2, On Ground Floor on Plot No. 3 and 4, 150 Ring Road, Rajkot - 360001 (Gujarat)



APPENDIX IV **POSSESSION NOTICE** (for immovable property)

Whereas, the undersigned being the Authorized Officer of Aadhar Housing Finance Limited (AHFL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of the Section 13 of the said Act read with Rule 8 of the Security nterest Enforcement rules, 2002. The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The borrower in particular and the public in genera are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of AHFL for an amount as mentioned herein under with interest thereon.

ΛΠ	An Liot an amount as mentioned herein under with interest thereon.							
Sr. No.	Name of the Borrower(s)/ Co-Borrower(s) (Name of the Branch)	Description of Secured Asset (Immovable Property)	Demand Notice Date & Amount	Date of Possession				
1	(Loan Code No. 39710000057 / Rajkot 3 Branch) Prasanta Maji (Borrower), Sibani Maji (Co-Borrower)	All that part & parcel of property Bearing, Flat No. 103 1 St Floor Samanvay Heights Bhagvati Para Main Road Plot No. 1 to 18 Rajkot, Gujarat - 360001. Boundaries : East - OTS, West - Wing-L Flat No. 101, North - OTS, South - Common passage	09-01-2024 8	28-03-2024				

Authorised Office Place : Guiarat Date: 30-03-2024 **Aadhar Housing Finance Limited**

CIN - L65110TN1921PLC001908

Tamilnad Mercantile Bank Limited

Plot No.25/C, 25/D,& 25/E Ground Floor, Animesh House, Kinnary Cinemas, Ringroad Branch, Surat - 395002, Gujarat Email:-surat_ringroad@tmbank.in, Phone No.0261- 2366500, 2367600

AUCTION NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

Auction Sale Notice for Sale of Immovable Assets mortgaged / charged to the Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provison to Rule 8 (6) and 9 (1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) M/s.Trisha Creation, Proprietor cum mortgagor : Mr. Gohil Rajeshbhai Jivanbhai, S/o. Mr. Jivanbhai Prashotambhai Gohil and Guarantor: Mrs.Gohil Dayaben Raieshbhai. W/o.Mr.Gohil Raieshbhai Jiyanbhai that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of Tamilnad Mercantile Bank Limited, Ringroad Branch, (Secured Creditor), will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 16.04.2024, for recovery of Rs.1,48,00,388.51 (Rupees One Crore Forty Eight Lakh Three Hundred Eighty Eight and Paisa Fifty One Only) (i.e. Overdraft of Rs.1,44,22,415.91 plus expenses of Rs.3,77,972.60) as on 29.02.2024 due to Tamilnad Mercantile Bank Limited, Ringroad Branch with subsequent interest and expenses. The Reserve Price will be Rs.69,00,000/- and the earnest money deposit will be Rs.6,90,000/-

Description of the property

tructed thereat to the extent of 2025 00 Individed proportionate share in Land and commercial building of Sq.ft Super Buildup Area, 1270.59 sq.ft Buildup Area and carpet area measuring 1216.87 sq.ft (113.04 sq.mt) situated at "MARK-POINT" Building - C, Shop No. C-110, First Floor, situated on Revenue Survey No. 128/2, Block No. 204, T.P.S No. 69 (Godadra-Dindoli), F.P No. 173, At. Dindoli, Surat, Tal. Choryasi, Dist. Surat, State Gujarat standing in the name of Mr.Rajesh Jivanbhai Gohil. Boundaries: North - Road, South - Shop No C-111, East - Shop No C-109, West - Adjacent Plaza

Encumbrance: Pendancy of special civil suit vide SPCS/110/2021 is pending before Civil Court Surat. For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured creditors website

(www.tmb.in) **Authorised Officer**

Place: Ringroad, Surat. Date: 23.03.2024

Tamilnad Mercantile Bank Ltd **Ahmedabad Regional Office** (For Ringroad Branch)



Mukka Proteins Limited

NG Road, Attavara, Dakshina Kannada, Mangaluru - 575001, Karnataka. Tel: +918244252889 Email: investors@mukkaproteins.com Website: www.mukkaproteins.com CIN: U05004KA2010PLC05577

Extract of standalone and consolidated unaudited financial results for the quarter and nine months ended December 31, 2023

		Standalone			Consolidated			
SI.	Particulars	Quarter ended December 31, 2023	Nine months ended December 31, 2023	Quarter ended December 31, 2022	Quarter ended December 31, 2023	Nine months ended December 31, 2023	Quarter ended December 31, 2022	
No.	T articulars	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	
1.	Revenue from operations	4,836.37	10,377.78	3,591.14	5,169.85	11,231.32	3,971.15	
2.	Net Profit for the period (before exceptional items and tax)	132.03	537.90	208.57	174.67	605.00	329.93	
3.	Net Profit for the period before tax (after exceptional items)	132.03	537.90	208.57	174.67	605.00	329.93	
4.	Net Profit for the period after tax (after exceptional items)	90.49	404.39	161.75	120.70	451.52	273.08	
5.	Total Comprehensive Income for the period	92.26	403.05	162.64	122.04	448.68	276.63	
6.	Equity Share Capital	220	220	220	220	220	220	
7.	Other equity	-	-	-	-	-	-	
8.	Earning/ (loss) Per Share (of Rs. 1/- each) Basic and Diluted (in Rs.)	0.41	1.84	0.74	0.48	1.95	1.03	

Notes:

Place : Mangaluru

Date: 28.03.2024

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirement) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock exchange(s) at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website
- The above Unaudited Standalone and Consolidated Financial Results for the quarter and nine months ended December 31, 2023 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on March 28, 2024. These Unaudited Standalone and Consolidated Financial Results have been subjected to limited review by the statutory auditors of the Company and they have issued an unmodified review report on these Unaudited Standalone and Consolidated Financial Results.

For and on behalf of the Board of Directors

(Rupees in million, except per share data and if otherwise stated)

Kalandan Mohammed Haris Managing Director & CEO

DEBTS RECOVERY TRIBUNAL - I

Ministry of Finance, Department of Financial Service, Government of India

2nd Floor, bhikhubhai Chambers, Near Kochrab Ashram, Ellisbridge, Paldi, Ahmedabad-380 006.
FROM NO. 22 [Earlier62] [Regulation 37(1) DRT Regulations, 2015]

[See rule52(1) of the Second Schedule to the Income Tax Act, 1961]

E-AUCTION | SALE NOTICE THROUGH REGD. A.D./ DASTI/ AFFIXATION/ BEAT OF DRUM

PROCLAMATION OF SALE UNDER RULES, 38, 52(2) OF SECOND SCHEDULE TO THE INCOME TAX ACT, 1961 READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT 1993. RC No. 136/2015 ASREC (INDIA) LTD., Certificate Holder **Certificate Debtors** MIS K. SITALDAS FABRICS PVT. LTD. & ORS.

M/S K. SITALDAS FABRICS PVT.LTD., (Principal Borrower) 301, Third Floor, Aashirvad Market, Railwaypura, Kalupur, Ahmedabad - 380002

ALSO AT: 101, 1st floor, Aashirvad Market, Railwaypura, Kalupur, Ahmedabad - 380002 Mr. Keshavdayal S. Jadwani, Director & Guarantor & Mortgager of Def. no.1, Row House No, 71, Sarthi Row House, Gurukul Road, Memnagar, Ahmedabad-380003. 98, Sarthi Row House, Gurukul Road, Memnagar, Ahmedabad-380003 Mr. Avinash S. Jadwani, Director & Guarantor & Mortgager of Def. no.1, Row House No, 71, 3 Sarthi Row House, Gurukul Road, Memnagar, Ahmedabad-380003. 98, Sarthi Row House, Gurukul Road, Memnagar, Ahmedabad-380003 Mr. Gulshan S. Jadwani, Director & Guarantor & Mortgager of Def. no.1, Row House No, 71, Sarthi Row House, Gurukul Road, Memnagar, Ahmedabad-380003. Mrs. Manisha A. Jadwani, Director & Guarantor & Mortgager of Def. no.1, Row House No, 76, Sarthi Row House, Gurukul Road, Memnagar, Ahmedabad-380003 Mrs. Anjali G. Jadwani, Director & Guarantor & Mortgager of Def. no.1, Row House No, 76, Sarthi Row House, Gurukul Road, Memnagar, Ahmedabad-380003 Mr. Dhiraj K. Jadwani, Guarantor & Mortgager of Def. no.1, Row House No, 71, Sarthi Row House, Gurukul Road, Memnagar, Ahmedabad-380003. **ALSO AT :-** 98, Sarthi Row House, Gurukul Road, Memnagar, Ahmedabad-380003 ALSO AT: - 462, Boyden Avenue, Maplewood, New Jersey-07040 (U.S.A.) Mrs. Pramila K. Jadwani, Guarantor & Mortgager of Def. no.1, Row House No, 71, Sarthi Row House, Gurukul Road, Memnagar, Ahmedabad-380003. ALSO AT: - 98, Sarthi Row House, Gurukul Road, Memnagar, Ahmedabad-380003

The under mentioned property will be sold by Public E-auction sale on 03rd day of May, 2024 for recovery of sum of Rs 12,82,15,986.62 (Rupees : Twelve crore Eighty Two lac Fifteen thousand Nine Hundred Eighty Six & Sixty Two paisa only) (As per interest certificate) plus interest and cost payable as per Recovery Certificate issued by Hon'ble Presiding Officer, DRT-(less amount already recovered, if any), from M/S K. SITALDAS FABRICS PVT. LTD. & ORS.

DESCRIPTION OF PROPERTY

No.	Description of the property to	Revenue	Details	Valuati	Claims if any, which	Reserve price	EMD 10%
of lots	be sold with the names of the co-owners where the property belongs to defaulter and any other person as co-owners.	assessed upon the, property orany part thereof	ofany other encum be- rances to which property is liable	on also state valuatio n given, if an;by the Certifi- cate Debtor	have been put forward to the property and any other known parti culars bearing on its nature	below which the property will not be sold	of Reserve Price or Rounded of
1	2	3	4	5	and value. 6	7	8
lot No.						Reserve price Rs.	10%EMD Rs.
1	ALL THAT PIECE & PARCEL of Shop bearing No.131 situated on First Floor, in the building known as Ashirwad A.C. Market situated on piece and parcel of land bearing City Survey Nos.1346 & 1347 paiki, Ward: Railwaypura, Tal. City in the registration Dist. and Sub District Ahmedabad belonging to Shri Keshavdayal S. Jadwani having built up area of 67.00 Sq.Ft.	NOT KNOWN	YES	NO	YES	2,58,000/-	25,800/-
2	ALL THAT PIECE & PARCEL of Shop bearing No.231 situated on Second Floor, in the building known as Ashirwad A. C. Market situated on piece and parcel of land bearing City Survey Nos.1346 & 1347 palki, Ward: Railwaypura, Tal. City in the registration Dist. and Sub District Ahmedabad belonging to Shri Keshavdayal S. Jadwani having built up area of 67.00 Sq.Ft.	NOT KNOWN	YES	NO	YES	2,25,000/-	22,500/-
3	ALL THAT PIECE & PARCEL of Shop bearing Nos.301, 302, 303, 304, 305, 306, 307, 308, 309 & 311(Hall) situated on Third Floor, in the building known as Ashirwad A. C. Market situated on piece and parcel of land bearing City Survey Nos.1346 & 1347 paiki, Ward: Railwaypuran Lal. City in sthe registration Dist and Sub District Ahmedabad belonging to Shri Keshavdayal S. Jadwani having built up area of 6269.20 Sq.Ft.	NOT KNOWN	YES	NO	YES	1,42,92,000/-	14,29,200/-
4	ALL THAT PIECE & PARCEL of Shop bearing No.310 situated on Third Floor, in the building known as Ashirwad A. C. Market situated on piece and parcel of land bearing City Survey Nos.1346 & 1347 paiki, Ward: Railwaypura, Tal. City in the registration Dist. and Sub District Ahmedabad belonging to Shri Keshavdayal S. Jadwani having built up area of 148.62 Sq.Ft.	NOT KNOWN	YES	NO	YES	4,16,000/-	41,600/-
5	ALL THAT PIECE & PARCEL of Shop bearing No.312 situated on Third Floor, in the building known as Ashirwad A. C. Market situated on piece and parcel of land bearing City Survey Nos.1346 & 1347 paiki, Ward: Railwaypura, Tal. City in the registration Dist. and Sub District Ahmedabad belonging to Shri Keshavdayal S. Jadwani having built up area of 159.00 Sq.Ft.	NOT KNOWN	YES	NO	YES	4,58,000/-	45,800/-
6	ALL THAT PIECE & PARCEL of Shop bearing Nos. 401, 402, 408 & 409, situated on Fourth Floor, in the building known as Ashirwad A. C. Market situated on piece and parcel of land bearing City Survey Nos.1346 & 1347 paiki, Ward: Railwaypura, Tal. City in sthe registration Dist. and Sub District Ahmedabad belonging to Shri Avinash S. Jadwani having built up area of 119530 Sq.Ft.	NOT KNOWN	YES	NO	YES	22,50,000/-	2,25,000/-
7	ALL THAT PIECE & PARCEL of Shop bearing Nos.404 situated on Fourth Floor, in the building known as Ashirwad A. C. Market situated on piece and parcel of land bearing City Survey Nos.1346 & 1347 paiki, Ward: Railwaypura, Tal. City in the registration Dist. and Sub District Ahmedabad belonging to Shri Avinash S. Jadwani having built up area of 284.00 Sq.Ft.	NOT KNOWN	YES	NO	YES	7,27,000/-	72,700/-
8	ALL THAT PIECE & PARCEL of Shop bearing Nos.410 situated on Fourth Floor, in the building known as Ashirwad A. C. Market situated on piece and parcel of land bearing City Survey Nos.1346 & 1347 paiki, Ward: Railwaypura, Tal. City in the registration Dist. and Sub District Ahmedabad belonging to Shri Avinash S. Jadwani having built up area of 165.00 Sq.Ft.	NOT KNOWN	YES	NO	YES	4,22,000/-	42,200/-

(2) The intending bidders should register the participation with the service provider - well in advance and get user ID and password for participating in E auction. It can be procured only when the requisite earnest money is deposited in prescribed mode below. (3) EMD shall be deposited by through RTGS/NEFT latest by **01-05-2024** as per details as under

 The shall be deposited by throught the contact by 01 00 2024 as per details as and or			
Bank Name	BANK OF INDIA		
Account Name	ASRECPS05/2015-16TRUST		
Account No.	009020110001172		
IFSC Code	BKID0000090		
Branch	SSI Andheri Branch, Mumbai		

EMD deposited thereafter shall not be considered for partiacipation in the e-auction. (4) In addition to above, the copy of PAN card, Address proof and Identity proof, Email ID, Mobile Number, in case of the Company, copy of Board Resolution passed by the Board of Directors of the company or any other document confirming representation /attorney of the company and the receipt/ Counter File of such deposit should reach to the said service provider through e-auction website by uploading soft copies on or before 01-05-2024 and also hardcopies alongwith EMDs deposit receipts should reach at the Office of Recovery Officer-II, DRT-I, Ahmedabay 01-05-2024. It is also held that earnest money of unsuccessful bidders shall be returned back in the respective accounts of such bidders through the same mode of payment. (5) Prospective bidder may avail online training from service provider.

bladers trilough the same mode of payi	ers through the same mode of payment. (b) i rospective bloder may avail online training from service provider.				
Name of Auction Agency	M/s C1 India Pvt. Ltd.				
AddressContact Person	403, GNFC Infor Tower Grand Bhagwati, SG Highway, Ahmedabad Mr. Bhavik Pandya, Mobile No. +91 8866682937				
Contact Person					
Helpline nos.	0124-4302020 21 22 23 24, Mobile Nos. +91 7291981124 25 26				
Email Address	gujarat@clindia.com & support@bankeauctions.com				
for any queries realated to auction and property contact	Shri Iyengar Padmanabhan, Mobile No. 9427068542 Email :- iyengar padmanabhan@asrecindia.co.in				

auction and property contact

(6) Prospective bidders are advised to visit website https://www.bankeauctions.com for detailed terms & conditions and procedure of sale before submitting thei bids. (7) The property shall not be sold below the reserve price. (8) The properties shall be sold in 8 lots, with reserve price as mentioned against each lot. (9) The bidder shall improve offer in mulpiles of Rs. 1,00,000-for lot no.3, Rs. 25,000/- for lot no.6 and Rs. 5,000/- for remaining lots (lot no.1,2,4,5,7 & 8) during entire auction period. (10) The property shall be sold "AS IS WHERE BASIS" and shall be subject to other terms & condition as published on the official website of the e-auction agency. (11) The highest bidder shall have to deposit 25% of his final bid amount after adjustment of EMD already paid by immediate next bank working day by 4.00 p.m. through RTGS/NEFT in the account as mentioned above. (12) The successful bidder fauction purchaser shall deposit the balance 75% of sale consideration amount on or before 15th day from the date of sale of the property. If the 15th day is Sunday or other holiday, than on immediate first bank working day through RTGS/NEFT in the account as mentioned above. In addition to the above the purchaser shall also deposit poundage fee at the rate 1% on the total sale consideration money (plus Rs.10/-) through DD in favour of The Registrar, DRT-I, Ahmedabad. (Ta) in case of default of payment within the prescribed period, the deposit, after deduction the expenses of the sale, may, if the undersigned thinks fit, be foreited to the Government account and the defaulting purchaser shall forfeit all claims to the property or the amount deposited. The property shall be resold forthwith, after the issue of fresh proclamation of sale. Further the purchaser shall also be liable to make good of any shortfall or difference between his final bid amount and the price for which it is subsequently sold.

[Date & Time of Inspection

	Date & Time of Inspection	19-04-2024	Between 02.00 pm to 04.00 pm
	Date of uploading proof of EMD/ documents	01-05-2024	upto 04.00 pm
	Last Date of submissions of hard copies of proof of EMD/document with office of the Recovery Officer	01-05-2024	upto 05.00 pm
	Date & Time of E-Auction	03-05-2024	between 12.00 Noon to 01.00 pm (with auto extension clause of 5 minutes, till auction completes

(15) The Recovery Officer has the absolute right to accept or reject any bid or bids or to postpone or cancel the ction without assigning any reasons

Issued under my hand and seal of the Tribunal on this 19th day of March, 2024.



•

આરસી નં. ૧૩૬/૨૦૧૫

સર્ટીફીકેટ હોલ્ડર

સર્ટીફીકેટ કેબ્ટર્સ

ઋણ વસુલી અધિકરણ - I અમદાવાદ

FROM NO. 22 [Earlier62] [Regulation 37(1) DRT Regulations, 2015] [See rule52(1) of the Second Schedule to the Income Tax Act, 1961] ઈ-ઓક્શન / વેચાણ નોટસ THROUGH REGD. A.D./ DASTI/ AFFIXATION/ BEAT OF DRUM આવકવેરા અર્દિનિયમ, ૧૯૬૧ની બીજી અનુસૂચિત નિયમો, ૩૮, ૫૨(૨) હેઠળ વેચાણની જાહેરાત બ્રેંક અને નાણાકીય સંસ્થાઓ અદિનિયમ ૧૯૯૩ને લીદે થયેલા દેવાની વસૂલાત સાથે વાંચો.

એએસઆરસીઈસી (ઈન્ડિયા) લિમિટેડ.

સી. ડી. નં. મેસર્સ કે. સીતલદાસ ફેબ્રિક્સ પ્રા. લી., (મુખ્ય ઉદ્યાર લેનાર) ૩૦૧, ત્રીજો માળ, આશીર્વાદ માર્કેટ,

સારથી રો-હાઉસ, ગુરુકુલ રોડ, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૦૩. ૯૮, સારથી રો હાઉસ, ગુરુકુલ રોડ, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૦૩

૭૬, સારથી રો-હાઉસ, ગુરુકુલ રોડ, મેમનગર, અમદાવાદ – ૩૮૦૦૦૩

આ ઉપરાંતઃ- ૯૮, સારથી રો હાઉસ, ગુરુકુલ રોડ, મેમનગર, અમદાવાદ – ૩૮૦૦૦૩ આ ઉપરાંતઃ- ૪૬૨, બોચડન એવન્યુ, મેપલવુડ, ન્યુ જર્સી-૦૭૦૪૦ (યુ.એસ.એ.)

ગુરુકુલ રોડ, મેમનગર, અમદાવાદ – ૩૮૦૦૦૩. આ ઉપરાંતઃ- ૯૮, સારથી રો હાઉસ, ગુરુકુલ રોડ, મેમનગર, અમદાવાદ – ૩૮૦૦૦૩

સારથી રો-હાઉસ, ગુરુકુલ રોડ, મેમનગર, અમદાવાદ – ૩૮૦૦૦૩

જે મિલકત વેચવાની છે તેના માલિકોનાં

અને સહમાલિકોના નામ તથા ડિકોલ્ટર

શ્રી કેશવદયાલ એસ. જાદવાણીની માલિકીન

સા કરાયદાવા માના અને હિસ્સો-શોપ ને. ૧૩૧, પહેલો માળ, આર્શીવાદ એ.સી. માર્કેટ નામે જાણીતી બિલ્ડીંગમાં, સીટી સર્વે નં. ૧૩૪૬ અને ૧૩૪૯ પૈકીની જમીનનો તમામ ભાગ અને

હિસ્સો, વોર્ડ : રેલ્વેપુરા, તાલુકો સીટી રજીસ્ટ્રેશન જિલ્લો અને સબ જિલ્લો અમદાવાદ, બિલ્ટ અપ

શ્રી કેશવદયાલ એસ. જાદવાણીની માલિકીની

આ કરાવદાવા અસ. વાદવાલાના માલકાના મિલકોતાના તમામ ભાગ અને હિસ્સો-શોપ નં. ર3૧, બીજો માળ, આર્શીવાદ એ.સી. માર્કેટ નામે જાણીતી બિલ્ડીંગમાં, સીટી સર્વે નં. ૧૩૪૬ અને ૧૩૪૯ પૈકીની જમીનનો તમામ ભાગ અને

હિસ્સો, વોર્ડ : રેલ્વેપુરા, તાલુકો સીટી રજીસ્ટ્રેશન જિલ્લો અને સબ જિલ્લો અમદાવાદ, બિલ્ટ અપ

શ્રી કેશવદયાલ એસ. જાદવાણીની માલિકીની મિલકોતનો તમામ ભાગ અને હિસ્સો-શોપ નં.

304, 302, 303,308,304,309,306,306,306 અને ૩૧૧ (હોલ) ત્રીજો માળ, આર્શીવાદ એ.સી. માર્કેટ નામે જાણીતી બિલ્ડીંગમાં, સીટી સર્વે નં. ૧૩૪૬ અને ૧૩૪૯ પૈકીની જમીનનો તમામ ભાગ

અને હિસ્સો, વોર્ડ : રેલ્વેપુરા, તાલુકો સીટી રજીસ્ટ્રેશનજિલ્લો અને સબ જિલ્લો અમદાવાદ, બિલ્ટ અપ એરિયા ૬૨૬૯.૨૦ ચો. ક્રુટ

શ્રી કેશવદચાલ એસ. જાદવાણીની માલિકીન

સા વરાવદવાલ અસ. જાદવાશાના માલકાના મિલકોતાનો તમામ ભાગ અને હિસ્સો-શોપ નં. 3૧૦, ત્રીજો માળ, આર્શીવાદ એ.સી. માર્કેટ નામે જાશીતી બિલ્ડીંગમાં, સીટી સર્વે નં. ૧૩૪૬ અને ૧૩૪૭ પૈકીની જમીનનો તમામ ભાગ અને હિસ્સો, વોર્ડ : રેલ્વેપુરા, તાલુકો સીટી રજીસ્ટ્રેશન જિલ્લો અને સબ જિલ્લો અમદાવાદ, બિલ્ટ અપ

શ્રી કેશવદયાલ એસ. જાદવાણીની માલિકીની મિલકોતનો તમામ ભાગ અને હિસ્સો-શોપ નં. ૩૧૨, ત્રીજો માળ, આર્શીવાદ એ.સી. માર્કેટ નામે જાણીતી બિલ્કીંગમાં, સીટી સર્વે નં. ૧૩૪૬

अने **१३४७ पै**डीनी જમीननो तमाम ભाગ अने હિસ્સો, વોર્ડ : રેલ્વેપુરા, તાલુકો સીટી રજીસ્ટ્રેશન જિલ્લો અને સબ જિલ્લો અમદાવાદ, બિલ્ટ અપ

શ્રી અવનીષ એસ. જાદવાણીની માલિકીની

મિલકોતનો તમામ ભાગ અને હિસ્સો-શોપ નં

૪૦૧,૪૦૨,૪૦૮ અને ૪૦૯ ચોથો માળ, આર્શીવાદ એ.સી. માર્કેટ નામે જાણીતી બિલ્ડીંગમાં, સીટી

સર્વે નં. ૧૩૪૬ અને ૧૩૪७ પૈકીની જમીનનો

તમામ ભાગ અને હિસ્સો, વોર્ડઃરેલ્વેપુરા, તાલુકો સીટી રજીસ્ટ્રેશન જિલ્લો અને સબ જિલ્લો

અમદાવાદ, ભિલ્ટ અપ એરિયા ૧૧૯૫.૩૦ ચો. કૂટ

શ્રી અવનીષ એસ. જાદવાણીની માલિકીની

૪૦૪ ચોથો માળ, આર્શીવાદ એ.સી. માર્કેટ નામે

જાણીતી બિલ્ડીંગમાં, સીટી સર્વે નં. ૧૩૪૬ અને

રાજળ પૈકીની જમીનનો તમામ ભાગ અને હિસ્સો, વોર્ડ : રેલ્વેપુરા, તાલુકો સીટી રજીસ્ટ્રેશન જિલ્લો અને સબ જિલ્લો અમદાવાદ, બિલ્ટ અપ એરિયા

શ્રી અવનીષ એસ. જાદવાણીની માલિકીની

भिवडोतनो तमाम ભાગ અને હिस्सो-शोप नं.

જવા ચોથો માળ, આર્શીવાદ એ.સી. માર્કેટ નામે જાણીતી બિલ્ડીંગમાં, સીટી સર્વે નં. ૧૩૪૬ અને ૧૩૪૯ પૈકીની જમીનનો તમામ ભાગ અને હિસ્સો,

વોર્ડ : રેલ્વેપુરા, તાલુકો સીટી રજીસ્ટ્રેશન જિલ્લો અને સબ જિલ્લો અમદાવાદ, બિલ્ટ અપ એરિયા

બેંકનું નામ

ખાતાનું નામ

ખાતા નંબર

આઈએકએસસી કોડ

स्डोतनो तमाम ભાગ અने ढिस्सो-शोप नं.

એરિયા ૬७.૦૦ ચો. કુટ

એરિયા ૬७.૦૦ ચો. કુટ

એરિયા ૧૪૮.૬૨ ચો. કુટ

એરિયા ૧૫૯.૦૦ ચો. ક્રુટ

૨૮૪.૦૦ ચો. કુટ

૧૬૫.૦૦ ચો. કૂટ

મેવાઈકર પાસેથી મેળવવી.

કોન્ટેક્ટ પર્સન

ઈમેલ એડ્રેસ

સરનામું

ઓક્શન એજન્સીનું નામ

પ્રોપર્ટીને લગતી કોઈપણ

(૧૪) હરાજીનું શિક્ચુલ નીચે મુજબ છે.

ર્ઘએમુડી/ડ્રોક્યુમેન્ટસના પ્રુફ અપલોડીંગ કરવાની

ઈએમડી/ડોક્યુમેન્ટસના પુરુની હાર્ડ કોપીઝ રીકવરી

ઓફિસરની ઓફિસમાં સબમીટ કરવાની છેલ્લી તારીખ

निरीक्षणनी तारीफ अने समय

રેલ્વેપુરા, કાલુપુર, અમદાવાદ – ૩૮૦૦૦૨ આ ઉપરાંતઃ- ૧૦૧, પહેલો માળ, આશીર્વાદ માર્કેટ, રેલ્વેપુરા, કાલુપુર, અમદાવાદ-૩૮૦૦૦૨

મે. કે. સિતલદાસ ફેબ્રિક્સ પ્રા. લિ. અને અન્થો

શ્રી કેશવદયાલ એસ. જાદવાણી, નિયામક અને બાંયધરી આપનાર અને મોર્ટગેજર ડેફના નં. ૧, રો હાઉસ નં, ૭૧,

શ્રી અવિનાશ એસ. જાદવાણી, ડિરેક્ટર અને ગેરેન્ટર અને મોર્ટગેજર ડેફ્ના નં.૧, રો-હાઉસ નં, ૭૧,

સારથી રો-હાઉસ, ગુરુકુલ રોડ, મેમનગર, અમદાવાદ-3cooo3. ૯૮, સારથી રો-હાઉસ, ગુરુકુલ રોડ, મેમનગર, અમદાવાદ-3cooo3 શ્રી ગુલશન એસ. જાદવાણી, ડિરેક્ટર અને બાંચધરી આપનાર અને મોર્ટગેગર ડેફના નં.૧, રો હાઉસ નં, ૭૧, સારથી રો હાઉસ, ગુરુકુલ રોડ, મેમનગર, અમદાવાદ-3cooo3 શ્રીમતી મનીષા એ. જાદવાણી, ડિરેક્ટર અને ગેરેન્ટર અને મોર્ટગેગર. ડેફના નં.૧, રો હાઉસ નં,

શ્રીમતી અંજિલ જી. જાદવાણી, ડિરેક્ટર અને બાંયધરી આપનાર અને મોર્ટગેજર ડેફના નં.૧, રો હાઉસ નં, ૭૬,

શ્રીમતી પ્રમિલા કે. જાદવાશી, બાંચધરી અને મોર્ટગેજર ડેફના નં.૧, રો હાઉસ નં, ૭૧, સારથી રો હાઉસ,

ઇ-ઓક્શન સેલ દ્વારા વેચાણમાં આવશે. (વ્યાજ પ્રમાણપત્ર મુજબ) ઉપરાંત માનનીય પ્રિસાઇડિંગ ઓફિસર, ડીઆટી- I દ્વારા જરી કરાયેલ વસૂલાત વ્યાજ અને ખર્ચ (ઓછી રકમ પહેલેથી વસૂલ કરવામાં આવી છે (જો કોઈ હોય તો), મે. કે. સિતલદાસ ફેબ્રિક્સ પ્રા. લિ. અને અન્ય પાસેથી

ઉપર ટેક્ષનું આકારણી

3

શ્રી ધીરજ કે. જાદવાશી, જામીનદાર અને મોર્ટગેજર ડેફના નં.૧, રો હાઉસ નં, ૭૧, સારથી રો–હાઉસ, ગુરુકુલ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦૦૦૩

નીચે જણાવેલ મિલકત રૂપિયા ૧૨,૮૨,૧૫,૯૮૬.૬૨ બાર કરોડ બ્યાસી લાખ પંદર હજાર નવસો છચાસી અને બાંસઠ પૈસા માત્ર)ની વસૂલાત માટે ૦૩ મે, ૨૦૨૪ ના રોજ જાહેર

મિલકતોનું વિવરણ

જાણમાં

होय तेवो

લાકા અન્ય

વ્યું હોય તો

SATURDAY, 30 • 03 • 2024 પોલિશ્ડ લેબગ્રો ડાયમંડ એક્સ્પોર્ટમાં ૩.૨૯ ટકાનો વધારો

કરદાતાએ એક એપ્રિલથી લાગુ થનારી સિસ્ટમ માટે જૂની કે નવીમાં રહેવાનો નિર્ણય કરવો પડશે

આઇટીમાં નવી ટેક્સ સિસ્ટમમાં ૮૦ સીનો લાભ કરદાતાને મળશે નહીં

ુ ધંધાદારી વ્યક્તિ નવી સિસ્ટમમાં જવાનો નિર્ણય કર્યા બાદ તેમાં ફેરફાર કરી શકશે નહીં

પગારદાર કર્મચારીઓને ફોર્મ ભરવામાંથી મુક્તિ

ઇન્કમટેક્સમાં નવી ટેક્સ સિસ્ટમનો અમલ આગામી એક એપ્રિલથી કરવામાં આવનાર છે. તેના માટે કરદાતાએ જૂની સિસ્ટમમાં રહેવુ કે નવીમાં તેનો નિર્ણય કરવાનો રહેશે. આ માટે ઇન્કમટેક્સમાં એક ફોર્મ ભરીને પહેલેથી જ આપી દેવાનુ રહેશે. જે કરદાતા તે ફોર્મ ભરીને નહીં આપે તેને આપોઆપ નવી સિસ્ટમ પ્રમાણે કરદાતાના ટેક્સની ગણતરી કરવામાં

ઓ.એ.નં. ૨૨૨/૨૦૧૨

રીઝર્વ કિંમતની

૧૦% ઈએમડી

અથવા રાઉન્ડેડ

ઓફફ

.

૧૦% ઈએમડી રૂા

24,000/-

89,500/

84, 200/

2,24,000/-

62,600/-

82,200/-

રીઝર્વ કિંમત

કે જેનાથી નીચે

આવશે નહીં

રીઝર્વ કિંમત 31.

2,46,000/-

2,24,000/-

4,82,62,000/-

8,95,000/-

8,46,000/-

22,40,000/-

6,26,000/-

8,22,000/-

સામેના કોઈ

ાવા જો હોય તે

અને મુલ્ય પરન अन्य वितगो

मुखांडन को अने तेना प्रडार

આવનાર છે. નવી સિસ્ટમમાં જે પણ કરદાતા જશે તેને ૮૦ સી પ્રમાણે પીપીએફ, એલઆઇસી. એનએસસી સહિતમાં જે ૧.૫૦ લાખનો લાભ મળતો હતો તે મળશે નહીં. તેની સામે ૩ લાખની આવક સામે એક પણ રૂપિયાનો ટેક્સ

પગારદાર કર્મચારીઓ દ્વારા જ્યારે ઇન્કમટેક્સનું રિટર્ન ભરવામાં આવે ત્યારે જ નક્કી કરી લેવાનું હોય છે કે તેઓ જૂની સિસ્ટમમાં રહેવા માંગે છે કે નવીમાં.તે પ્રમાણે રિટર્ન ભરપાઇ કરવામાં આવે તો તેઓને ફોર્મ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમ છતાં કર્મચારી દ્વારા જૂનીના બદલે નવી સિસ્ટમ પ્રમાણે ગણતરી કરીને ટેક્સ ભરે તો તે પ્રમાણે ટેક્સની વસુલાત થશે.

વસુલ કરાશે નહીં. જ્યારે જૂની સિસ્ટમમાં ૨.૫૦ લાખ સુધીની આવક ટેક્સ મુક્ત ગણવામાં આવશે. જોકે નવી સિસ્ટમમાં સરકારી કર્મચારીઓ દ્વારા નેશનલ પેન્શન સ્કીમમાં ૫૦ હજાર રૂપિયા સુધીના કરેલા રોકાણ કરમુક્ત ગણવામાં આવશે. કરદાતાએ નવી સિસ્ટમમાં રહેવા માટે ૩૧ જુલાઇ પહેલા ઇન્કમટેકસમાં ફોર્મ ભરીને જમા

કરાવવાનુ રહેશે. જ્યારે જે પણ કરદાતાએ એટલે કે વેપાર- ધંધા સાથે સંકળાયેલા ના હોય તેઓ પહેલા નવી સિસ્ટમમાં હતા અને હવે જૂની સિસ્ટમમાં જવા માંગે છે તો તેવા કરદાતાઓએ પણ ફોર્મ ભરવાનુ રહેશે. નહીંતર તેઓને નવી સિસ્ટમ પ્રમાણે જ ગણતરી કરીને ટેક્સની ચુકવણી

નેચરલ ડાયમંડના એક્સ્પોર્ટમાં સતત ઘટાડો અને લેબગ્રોનમાં વધારો નોંધાયો

છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી હીરાઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સ્પોર્ટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત ફેબ્રુઆરી, ૨૦૨૩ની તુલનામાં ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સ્પોર્ટમાં ૨૭ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જ્યારે પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના એક્સ્પોર્ટ

૩.૨૯ ટકાનો વધારો થયો છે. વૈશ્વિક મંદીની અસર સુરતના ઉદ્યોગ પર જોવા મળી રહી છે. જેને પગલે એક્સ્પોર્ટમાં સતત ઘટાડો દેખાઈ રહ્યો છે. ગત વર્ષે ફેબ્રુઆરી, ૨૦૨૩માં રૂ. ૧૯,૫૮૨ કરોડના કટ એન્ડ પોડિશ્ડ ડાયમંડ એક્સ્પોર્ટ થયા હતા. જે આ વર્ષે ફેબ્રુઆરી, ૨૦૨૪માં ઘટીને રૂ. ૧૪,૧૬૨ કરોડનું અક્સપોર્ટ થયું છે. જેને પગલે હીરાઉદ્યોગમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી જાણે ઉદ્યોગ માટે મોટા સપોર્ટ સમાન સાબિત થઈ રહી હોય તેમ ગત ફેબ્રુઆરી, ૨૦૨૩ની તુલનામાં ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક્સ્પોર્ટમાં વધારો જોવા મળ્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ મુજબ ગત ફેબ્રુઆરી, ૨૦૨૩ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડનું રૂ. ૧૦,૫૮૨ કરોડનું એક્સ્પોર્ટ હતું. જે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં વધીને રૂ. ૧,૧૫૩ કરોડ થયું છે. આમ, ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના એક્સ્પોર્ટ ૩.૨૯ ટકાનો વધારો નોંધાયો છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદથી હીરાઉદ્યોગ પર સતત અસર પડી રહી છે. હાલમાં જ જી-૭ દેશો દ્વારા પણ રશિયાના ૧ કેરેટથી વધુના હીરા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે ૧ માર્ચથી અમેરિકા સહિતના દેશોમાં રશિયાના હીરા એક્સ્પોર્ટ થઇ શકતા નથી.

ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષ નેચરલનું એક્સ્પોર્ટ ૨૭ ટકા ઘટ્યું

વિદેશથી આવનારમાં RSVથી પીડાતા કેસો જોવા મળે છે અમેરિકાથી આવનાર કેટલીક વ્યક્તિઓ જેમાં તાવ ખાંસી શરદી જેવા લક્ષણો જોવા

મળતા હોય છે. તેઓ RSVથી પીડાતા હોય છે. અમેરિકામાં આ વાયરસથી પીડાતા

દર્દીઓ જોવા મળે છે. જે ખાસ નુકસાનકારક નથી. અમેરિકાથી શહેરમાં આવતા

advantage

કેટલીક વ્યક્તિઓમાં તે જોવા મળે છે. જો એક અઠવાડિયામાં સ્વસ્થ થઇ જાય છે.

દર મંગળવાર, ગુરુવાર અને શનિવાર

સંદેશ

કોરોના અને સિઝનલ ફ્લૂથી પીડાતા પાંચ દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ વડોદરામાં કોરોનાનો પગપેસારો, એક વૃદ્ધ કોરોનાની ઝપટમાં

વેકેશન, મેળાવડામાં લોકોની ભીડ એકઠી થતી હોવાથી ખાસ કાળજી લેવા સૂચન

શહેરના નવાયાર્ડના બે વૃદ્ધભાઇ ઓ પૈકી એક કોરોના અને એક સિઝનલ ફલૂની ઝપટમાં જયારે આજવારોડનો પ્રૌઢ અને છાણી જકાતનાકાનો યુવાન કોરોનાની ઝપટમાં આવી ગયા છે. સયાજી હોસ્પિટલમાં હાલ કોરોનાના ત્રણ અને સિઝનલ ફલૂના બે દર્દીઓ મળી પાંચ દર્દીઓ સારવાર હેઠળ છે.

સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓમાં બે દર્દીઓ વૃદ્ધ છે. બન્ને દર્દીઓ સયાજી હોસ્પિટલમાં પલમોનરી ડિપાર્ટમેન્ટમાં સારવાર હેઠળ હતા. બન્નેને ફેફસાના ચેપ લાગ્યો હતો. તેઓની તપાસ કરવામાં આવતા તેઓ કોરોનાના ચિત્નો જણાયા હતા.આથી તેઓને સારવાર માટે અલાયદા વોર્ડમાં ખસેડાયા હતા. જયારે આજવારોડના ખાંસીથી લાંબા સમયથી પીડાતા દર્દીઓએ ફ્રીઝનું પાણી પીવાનું ટાળો

હાલમાં શરદી,ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જોકે આ દર્દીઓ સારવાર દરમિયાન શરદી અને તાવ મટી જાય છે. પરંતુ ખાંસી લાંબો સમય સુધી ચાલે છે. આ દર્દીએ ૧૫ થી ૨૦ દિવસ સુધી ખાસીથી પીડાતા રહે છે. ખાસીથી બચવા માટે ફ્રીજન ઠડ્ પાણી પીવુ જોઇએ નહીં. જયારે હુંફાળુ (મીક્ષ પાણી) પીવુ જોઇએ આ ઉપરાંત એસીમાંથી સીધા તાપમાં જવાનું પણ ટાળવુ જોઇએ તેવી તબીબી નિષ્ણાંતોની સલાહ છે.

પ્રૌઢ પણ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. આ ઉપરાંત નવાયાર્ડ અને દોડકા ગામના બે વૃદ્ધો સિઝનલ ફ્લૂની ઝપટમાં આવી ગયા છે.

કોરોનાના દદીઓની સંખ્યામાં સાધારણ વધારો નોંધાયો છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાય તેવો હાલમાં કોઇ સ્થિતિ જણાતી નથી. ફેફસાં, શ્વાસના રોગથી પીડાતા દર્દીઓમાં કોરોનાના લક્ષણો

જોવા મળે છે. જોકે હાલમાં બદલાયેલી ઋતુના લીધે સિઝનલ ફલૂના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે ટેસ્ટિંગ વધારવામાં આવેતો સિઝનલ ફ્લૂના દર્દીઓની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા છે. હાલમાં વેકેશનની સિઝન ઉપરાંત મેળાવડામાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થવાની સંભાવના છે ત્યારે તેમાં સિઝનલ ફ્લ્ ઝડપથી ફેલાઇ શકે છે.

પોલીસે સંજય કનુભાઇ ગેલાણી (ઉ.

વ.૩૮, રહે- લક્ષ્મીનગર, એલ.એચ.

રોડ, વરાછા- મૂળ ભીંગરાડ. લાઠી.

અમરેલી), વિશાલ મહેશ તેજાણી

(ઉ.વ.૩૬, રહે-શબરીધામ રોહાઉસ,,

ધી કુકરવાડા નાગરિક સહકારી બેંક લિ. નાગરિક ભવન, માર્કેટથાર્ડ, મુ.- કુકરવાડા - ૩૮૪૫૩૦, તા. વિજાપુર, જી. મહેસાણા મોબાર્ઇલઃ ૯૬૬૪૬૪૧૩૬૨ ક્રમ જગ્યાનું નામ લાયકાત રોજ ૪૫ વર્ષથી ૧૧/૦૪/૨૦૨૪ના બેન્કના રોજબરોજના બેન્કીંગ કાર્ચભાર ઉપરાંત ધિરાણ, એન.પી.એ., રીક્વરી, લીગલ કામકાજ સંભાળી શકે તેવા. બેંકમાં મિડલ/ સીનીયર લેવલના ઓછામાં ઓછા પ વર્ષના અનુભવી એવા ઉત્સાહી ઉમેદવારો તેમની લાયકાત અને અનુભવના પુરાવા. હાલની પગાર સ્લીપ તથા અપેક્ષિત પગાર સાથેની લેખિતમાં અરજી દિન ૧૦ માં બેન્કના ઉપરોકત સરનામે મોકલી આપવી. ચેરમેનશ્રી, દી કુકરવાડા નાગરિક સહકારી બેંક લિ.

Digital Industry Pwg Lag Solutions

since 1993 with offerings in PLC Systems, Drives, SCADA & HMI systems, Field Instrumentation, Industrial IT & IoT solutions. We're looking for talented individuals to join our team at AHMEDABAD Branch. VACANCY LISTING Sr. Sales Executive

Hi-MAK Pvt. Ltd. is a leading Industrial Systems Integrator and Solutions provide

1 3 to 7 Years' Experience in Sales of Automation Systems BE/B.Tech in Electrical, Electronics, Instrumentation, Mechatronics Project / Service Engineer

SCAN THE OR COD BE/B.Tech in Electrical, Electronics, Instrumentation, Mechatronics Link to Application Form: https://lnkd.in/dipzSxDE APPLICATION FORM

In case of difficulties accessing the URL, please send us your resumes to the email id mentioned below **WE ARE HIRING**

⊕ www.himak.in

® 0265 279 5413

✓ recruitment@himak.in Head Office: 201-209 Blue Diamond Complex, Fatehgunj Crossroad, Fatehgunj, Vadodara - 390002 Branch Office: 311, Empire Hub, Ghodasar Cross Road, Nr. Ishanpur, Ghodasar, Ahmedabad



Applications are invited for the posts of Lecturer, Assistant/ Associate Professor / Professor in above disciplines

FOR B.TECH/BCA (FRESHER) - CTC 3.0 - 4.0 LAC/ ANNUM • FOR M.TECH/MCA (FRESHER) - CTC 4.8 - 6.0 LAC/ ANNUM Outstation Candidates Shall Be Paid 10-15k Per Month Additional Salary As

Relocation Allowance. *NO BAR FOR EXPERIENCED & DESERVING CANDIDATES **WALK-IN INTERVIEW IN AHMEDABAD**

Address: City Center Building, Shop No. 21, Upper Floor, Nr. Swastik Cross Roads, C G Road, Ahmedabad Date & Time: March 31, 2024 (Sunday), 09:30 AM Qualification & experience as per AICTE norms. Interested candidates can also app

> **OSBI** સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા

through www.paruluniversity.ac.in/careers

તારીખઃ 20.03.2024

સેન્ટ્રલ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન ડિપાર્ટમેન્ટ કોર્પોરેટ સેન્ટર, મુંબઈ ઈમેઈલઃ crpd@sbi.co.in

Registra

કોન્ટ્રાક્ટના ધોરણે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સની ભરતી કોન્ટ્રાક્ટના ધોરણે નિમ્નલિખિત હોદ્ધાઓ માટે ભારતીય નાગરિકો પાસેથી અરજીએ મગાવવામાં આવે છે:

शहेरात नं. CRPD/SCO/2023-24/34 ખાલી હોદ્ધો સમકક્ષ ગ્રેડ हेड (કોર્પોરેટ કોમ્યુનિકેશન ટીઈજીએસ-VII

એન્ડ માર્કેટિંગ) પાત્રતા માપદંડ (ઉંમર, અનુભવ, કામની રૂપરેખા વગેરે), ખાલી જગ્યાની વિગતો, આવશ્યક ફી અને અન્ય વિગતો માટે અરજી ઓનલાઈન સુપરત કરવા અને અરજીની ફી ઓનલાઈન ભરવા માટે લિંક સાથે બેન્કની વેબસાઈટ https://bank.sbi/web/careers પર લોગ ઓન કરો. અરજી કરવા અને ફી ભરવા પૂર્વે પાત્રતા અને અન્ય વિગતોની ખાતરી કરવા માટે વિગતવાર જાહેરાત જુઓ. કોઈ પણ પૂછપરછ માટે કૃપા કરીને અમને લિંક "CONTACT

US" —> "Post Your Query" થકી લખો, જે બેન્કની વેબસાઈટ (https://bank.sbi/web/careers/post-your-query) પર ઉપલબ્ધ છે. ઓનલાઈન અરજી ભરવાની અને ફીની ચુકવણીની તારીખઃ 20.03.2024 થી

09.04.2024 관회. સ્થળ: મંબઇ

જનરલ મેનેજર (આરપી એન્ડ પીએમ)

સુરતમાં નકલી ડિગ્રી બનાવવાના આંતર રાજ્ય કૌભાંડનો પર્દાફાશ, લંડન અને કેનેડા રહેતા સુરતના યુવકો સૂત્રધાર મામલે ગુનો દાખલ કરાયો હતો.

ા સુરત ા

વિદેશ જવા નકલી ડિગ્રી-માર્કશીટ બનાવવાના કૌભાંડનો સિંગણપોર પોલીસે કરેલા પર્દાફાશ બાદ આ પ્રકારનું વધુ એક રેકેટ ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યું છે. વિદેશ જવા તથા અન્ય સરકારી કામકાજ માટે દેશના અલગ-અલગ

જાહેર નોટીસ

શ્રી હાર્દિક સી. સતાસીયા એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ, દસકોઇ મામલતદાર, અમદાવાદની કોર્ટ

કેસ નં. ૨૦૭/૨૦૨૪

અરજદાર : પટેલ સ્મેશભાઇ ચતુરભાઇ રહે.: ૮૦૬, નાની ખડકી, કુહા, તા. દસક્રોઇ, જી. અમદાવાદ સામાવાળા : તલાટી કમ મંત્રી,

બાકરોલ-બુજરંગ, તા. દસકોઇ, જી. અમદાવાદ. જન્મ-મરણ નો ધણી અધિનિયમ-૧૯૬૯ની કલમ

૧૩(૩) હેઠળની અરજી એન્વયે જાહેર નોટીસ આથી લાગતા વળગતા ઇસમોને જણાવવાનું કે, અરજદારના ભત્રીજીથ્રી નામે કામીનીબહેન કાન્તીલાલ પટેલનો જન્મ તા. ૧-૬-૧૯૭૪ના

રોજ ગામ-બાકરોલ-બુજરંગ, તા. દસક્રોઇ, જી. અમદાવાદ.

મુકામે થયેલ પરંતુ જે તે વખતે કાયદાની અજ્ઞાનતાને કારણે તેમના જન્મની નોંધ બાકરોલ-બુજરંગ ગ્રામ પંચાયતના રેકર્ડ દફ્તરે કરવાની રહી ગયેલ હોય, જન્મની નોંધ કરાવવા અરજી

કરેલ છે. આ અરજીના અનુસંધાનમાં કોઇ ઇસમને વાંધા યા તકરાર હોય તો આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયા તારીખથી ૩૦

દિવસ સુધીમાં અત્રેની કોર્ટમાં જરૂરી આધાર પુરાવા સાથે વાંધો રજુ કરવો અન્યથા આગળની ન્યાયીક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની લાગતા વળગતા ત્મામ ઇસમોએ નોંધ લેવી.

આજ તા. ૨૮-૦૩-૨૦૨૪ના રોજ મારી સહી તથા કોર્ટનો

સહી/- એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને

શિક્ષણ બોર્ડ અને યુનિ.ની નકલી ડિગ્રી-માર્કશીટ બનાવી આપી લખલૂંટ કમાણી કરતી આંતરરાજ્ય ટોળકીના ૩ સાગરીતોને પકડી પાડ્યા હતા. જ્યારે કેનેડા અને લંડનના બે મળી સુરતના ૩ માસ્ટર માઇન્ડને વોન્ટેડ જાહેર કરાયા છે.

> દેશના અલગ-અલગ રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીઓની નકલી ડિગ્રી, માર્કશીટો સહિતના પ્રમાણપત્રો બનાવી આપી લોકો પાસે ઊંચી રકમ વસૂલાતી હોવાની બાતમી મળતા ઉત્રાણ પીઆઇ એ આ દિશામાં વર્કઆઉટ કરી સમગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઉત્રાણ પોલીસે ગત તા.૧૧ જાન્યુઆરીએ માર્કશીટ-ડિગ્રી વિગેરે મળી આવતા શંકાસ્પદ લાગતા ખરાઇ કરાવી હતી. તમામ સર્ટિફિકેટ બોગસ

હોવાનો ખુલાસો થતા આ

સુદામાચોક પાસે, મોટાવરાછા- મુળ ઘેટી, પાલિતાણા, ભાવનગર) અને મળતી વિગતો પ્રમાણે વિદેશ જવા તેમજ સરકારી કામકાજો માટે ધ્રુવિન મગન કોઠિયા (ઉ.વ.૨૪, રહે-કૃષ્ણકુંજ સોસાયટી, લજામણી ચોક પાસે, મોટાવરાછા- મુળ ગીણીયા, ખાંભા, અમરેલી)ની ધરપકડ કરી હતી.

Require

આ રેકેટના માસ્ટર માઇન્ડ નિલકંઠ નરશીભાઇ દેવાણી (સુરત-હાલ રહે- કેનેડા), બોની વિનોદભાઇ તાલા (રહે-સુરત, હાલ રહે- લંડન,યુકે) અને વૈભવ અશ્વિન તાલા (રહે-ભગવાનનગર, કાપોદ્રા)ને વોન્ટેડ જાહેર કરાયા છે. આ ટોળકી રૂપિયા દ્દપ હજારથી ૧.૫૦ લાખ સુધીમાં નકલી ડિગ્રી તથા માર્કશીટ સહિતના પ્રમાણપત્રો બનાવી આપતી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે.

ડેડિકેટેડ ફેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભારત સરકાર (રેલવે મંત્રાલય) સાહસ

rનરલ મેનેજરની ઓફિસ, ડેડિકેટેડ ફેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ઓસીસી બિલ્ડિંગ, 'ડી' કેબિન રોડ, સાબરમતી અમદાવાદ –૩૮૦૦૧૯ નોટિસ નં. ૨૨/૨૦૨૩-૨૪ બિડો (માત્ર ઈ-ટેન્ડર) આમંત્રિત

હોલિક લે. સ્ટ્રેસ્ટરને કરાઇક (નાત્ર ઇન્ટરકર) ઝાલાંગતા ટેન્ડર નં. DFC_ADI_EL_TW_01_2023-24, કામનું નામ : ક્યૂમિન્સ મેક ડીગલ એન્જિનો (મોડલ-એન્ટીએ-૮૫૫આર) તથા સંવગ્ન ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોન્ચૂમેટિક અને ૦૨ નં. ડીગલ ઇલેક્ટ્રિક ટાવર કારો (ડીઇટીસી - ટિવન ડ્રાઇવ અન્ડર સ્લંગ ટાઇપ)ની હાઇડ્રોલિક સિસ્ટમો માટે સમાવેશક જાણવણી કરાર ટેન્ડર મૂલ્ય : રૂા. ૫૨,૯૦,૫૩૮.૨૪(છુએસટી સહિત) (રૂપિયા બાવન લાખ સત્તાણુ હજાર પાંચસો આડગીસ ને ચોવીસ પૈસા પૂરા) પૂર્ણાંહુતિ સમયગાળોઃ ૨૪ (ચોવીસ) માસ , બિડ સિક્યુરિટીઃ રૂા. ૧,૦૬,૦૦૦/–(રૂપિયા એક લાખ છ હજાર પૂર (www.ireps.gov.in પરના પેમેન્ટ ગેટ વે દ્વારા ઓનલાઈન ચુકવણી) ટેન્ડર દસ્તાવેજ મૃત્ય રૂા. ૫,૯૦૦ (રૂપિયા પાય હજાર નવસો પૂરા) (www.ireps.gov.in પરના પેમેન્ટ ગેટવે દ્વારા ઓનલાઇન ારંભ તારીખ : ૦૩–૦૪–૨૦૨૪, બિડિંગ બંધ થવાથી તારીખ અને સમય ૧૭–૦૪–૨૦૨૪ના રોજ ૧૫–૦૦ કલાક સુધી ઇ–ટેન્ડરિંગ વેબસાઇટ સરનામું : www.ireps.gov.in, www.ireps.gov.in/itslink ત ww.dfccil.com પર www.ireps.gov.in ની લિન્ક (આઈઆરઈપી એસ હેલ્પ ડેસ્ક : ૦૧૧–૨૩૭૬૧૫૨ ઝોફિસનું સરનામું : ચીફ જનરલ મેબેજરની ઓફિસ, ડેડિકેટેડ ફેઇટ કોરિટોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ઝેસીસી બિલ્ડિંગ 'ડી' કેબિન રોડ, સાબરમતી, અમદાવાદ –૩૮૦૦૧૯, ગુજરાત, વેબસાઇટો આ ટેન્ડર દસ્તાવે www.ireps.gov.in અને www.dfccil.com ડીએક્સીસીઆઇએલની વેબસાદીટ પરથી ડાઉનલોડ કરે કાશે. આ ટેન્ડર દસ્તાવેજો માત્ર વેબસાઈટ www.ireps.gov.in દ્વારા જ સબમિટ કરી શકાશે, ઓ ાયની ઓફર સ્વીકૃત કરવામાં આવશે નહીં. સુધારો/વધારો માત્ર ઉપરોક્ત વેબસાઈટો પર જ મુકવામાં આવશે. ચીફ જનરલ મેનેજર, ડીએફસીસીઆઈએલ, અમદાવાદ

> 'આનંદી મા ગુરુ ધ્યાનયોગીજી કલ્યાણ કેન્દ્ર" અને " શ્રી ઘ્યાનયોગીજી વેલ્ફેર ફાઉન્ડેશન" ટ્રસ્ટ, નિકોરા, જિ. ભરૂચ

જાહેર નોટીસ ઉપરોક્ત બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરફથી પૂ. ગુરુદેવ શ્રી મધુસૂદનદાસજી અને પૂ. આનંદી મા નાં શિષ્યવર્ગ અને અન્યોની જાણ માટે આ નોટીસ જાહેર કરવામાં આવે છે કે, પૂ. ગુરુદેવ શ્રી મધુસૂદનદાસજીની આજ્ઞા અને પ્રેરણા અનુસાર પૂ. શ્રી આનંદી મા દ્વારા, ભારતમાં સ્થાપિત અને સંચાલિત એવી ફક્ત બે જ સંસ્થાઓ (ટ્રસ્ટ)- "આનંદી મા ગુરુ ધ્યાનયોગીજી કલ્યા**છ** કેન્દ્ર"(નિકોરા) અને "શ્રી ધ્યાનયોગીજી વેલ્ફેર ફાઉન્ડેશન" (નિકોરા) છે. આ સિવાય ભારતની અન્ય કોઈ સંસ્થા/ટ્રસ્ટ સાથે પૂ. શ્રી આનંદી મા કે પૂ. શ્રી બાપુજી (શ્રી દિપકજી પાઠક) જોડાયેલા નથી. આથી પૂર્િશ્રી આનંદી માં, પૂર્િશ્રી બાપુજી અથવા આ બે ઉપરોક્ત ટ્રસ્ટ ના નાર્મથી અન્ય કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા - સાધકો કે અન્ય વ્યક્તિઓ પાસે આર્થિક કે અન્ય કોઇ સહાય માંગે તો એ અંગે ઉપરોક્ત પૂ. શ્રી આનંદી મા, પૂ. શ્રી બાપુજી, બંને સંસ્થાઓની કે તે સંસ્થાના ટ્રસ્ટીઓની કોઈ પણ જવાબદારી રહેશે નહી તેની નોંધ લેવી.

"આનંદી મા ગુરુ ધ્યાનયોગીજી કલ્યાણ કેન્દ્ર" તથા "श्री ध्यानयोगील वेल्हेर झઉन्डेशन" ना ट्रस्टीगए

for Reputed Builder Site @ Gandhinaga Whats App: 99045 53757 Walk In Interview On Tuesday

Marketing Staff: Experienced

Time: 11am To 1pm

જાહેર નોટીસ શ્રી હાર્દિક સી. સતાસીયા એક્ઝિક્યુ મેજીસ્ટ્રેટ, દસકોઇ મામલતદાર, અમદાવાદની કોર્ટ

નં. મામ.દ./એમ એ.જી./જન્મ-મરણ / નોંધણી / અસ્જદાર : પટેલ હર્ષદભાઇ મુળજીભાઇ રહે.: ૪૧૪, કુબડથલ, તા. દસકોઇ, જી. અમદાવાદ. સામાવાળા : તલાઢી ક્રમ મંત્રી,

Female / Male

તામાળા : તલાટા કર્મ મત્રા, જુબદચલ, તા. દસકોઇ, જી. અમદાવાદ. જન્મ-મરણ નોંધણી અધિનિયમ-૧૯૬૯ની કલમ ા ૩(૩) હેઠળની અરજી અન્વયે જાહેર નોટીસ આથી લાગતા વળગતા ઇસમોને જણાવવાનું કે, અરજદારના ભાઇ નામે શ્રી પટેલ નવિનકુમાર મુળજીભાઇનો જન્મ તા. ૨૩-૧-૧૯૭૧ના પુટલ પાયપકુષાર ચૂળકખાઇના જેમ તો. રહેરા ને રહિકો પો રોજ ગામ-કુબડથલ, તો. દસકોઇ, જે. અમદાવાદ, મુકામે થયેલ પરંતુ જે તે વખતે કાયદાની અજ્ઞાનતાને કારણે તેમના જન્મની નોધ કુબડથલ ગ્રામ પંચાયતના રેકર્ડ દક્તરે કરવાની રહી ગયેલ હોય, જન્મની નોધ કરાવવા અરજી કરેલ છે. આ બરજીના અનુસંધાનમાં કોઇ ઇસમને વાંધા યા તકરાર હોય તો આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયા તારીખથી ૩૦ દિવસ સુધીમાં . બત્રેની કોર્ટમાં જરૂરી આધાર પુરાવા સાથે વાંધો રજુ કરવો બુન્યથા આગળની ન્યાયીક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની લાગતા વળગતા તમામ ઇસમોએ નોંધ લેવી. આજ તા. ૨૮-૦૩-૨<u>૦૨</u>૪ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરી લોટનો સહી/- એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને સિક્કો મામલતદાર દસકોઇ, અમદાવાદ.

(૧) હરાજી બોલી કરત "ઓનલાઇન ઇલેક્ટ્રોનિક્સ બીડીંગ" થી વેબસાઇટ એટલે કે https://www.bankeauctions.com દ્વારા કરવામાં આવશે. (૨) ઇચ્છુક બીડરોએ ઇ-હરાજીમ ભાગ લેવા માટે સર્વિસ પ્રોવાઇડર પાસે અગાઉથી નોંધણી કરાવીને યુઝર આઇડી અને પાસવર્ડ મેળવી લેવા કે જે ત્યારે જ મળશે કે જ્યારે જરુરી ઇએમડી નીચે મુજબના નિર્ધારીત રીતે ભરવામાં આવી હશે.

એએસઆરઈસીપીએસ૦૫/૨૦૧૫-૧૬ ટ્રસ્ટ

૪૦૩, જીએનએફસી ઈન્ફોર ટાવર ગ્રાન્ડ ભગવતી, એસ જી હાઈવે, અમદાવાદ

gujarat@clindia.com & support@bankeauctions.com

Email :- lyengar.padmanabhan@asrecindia.co.in

0124-4302020|21|22|23|24, Mobile Nos. +91 7291981124|25|26

બોપોરે **૦૨.૦૦ થી સાંજે ૦૪.૦૦ દરમ્યા**ન

બોપોરે ૧૨.૦૦ થી બપોરે ૦૧.૦૦ દરમ્યાન (પ્રત્યેક પાંચ મિનિટા

આપોઆપ સમય વધારા સાથે વેચાણ પુરું થાય ત્યાં સુધી)

સાંજે ૦૪.૦૦ વાગ્યા સુધી

સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી

(3) અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઇએમડી) RTGS/NEFT/Fund Transferમારફતે તા. ૦૧-૦૫-૨૦૨૪ સુધીમાં નીચે જણાવેલ વિગતો મુજબ જમા કરાવવાની રહેશે.

ਮੇ. સੀ ੧ ઇન્ડિયા પ્રા. લિમિટેડ

બેંક ઓફ ઈન્ડિયા

5926000000000

BKID0000090

એસએસઆઈ અંદોરી શાખા, મુંબઈ

pie જમા કરાવેલી ઇએમડી ઇ-હરાજીમાં ભાગ લેવા માટે માન્ય ગણાશે નહીં.(૪) ઉપરની વિગતો ઉપરાંત પાનકાર્ડની કોપી, એડ્રેસ પુરૂ અને ઓળખનો પુરાવો, આઇડી, મોબાઈલ નંબર, કંપનીના કિસ્સામાં બોર્ડ ઓપ કિરેક્ટરોએ પાસ કરેલી રેઝોલ્યુએશનની કોપી અને અન્ય કોઈ દસ્તાવેજો કે જે કંપનીનું મંદિત્વ/એટર્ની સાબીત કરતો દસ્તાવેજ અને આવી ડિપોઝીટ કર્યાની પહોંચ/કાઉન્ટર ફોઈલ વગેરે ઉપર દર્શાવેલ સર્વિસ પ્રોવાઈડરને આ કોપી તા. ૦૧-૦૫-૨૦૨૪

અથવા તે પહેલાં અપલોક કરવી અને ઈએમડી રસીદી સાથેની હાર્ડ કોપીઝ પણ તા. ૦૧-૦૫-૦૨૪ સુધીમાં ઓફિસ ઓફ રીકવરી ઓફિસ-૧, ડીઆરટી-૧, અમદાવાદ ને પહોંચાડવાની રહેશે. નિષ્ફળ બોલીકારની ઈએમડી તેનાસંબંધિત ખાતામાં આ જ પધ્ધતિ થી જમા કરવામાં આવશે. (૫) ઇચ્છુક બીડરોએ ઓનલાઇન ટ્રેનિંગ સર્વિસ

શ્રી ભાવિક પંડ્યા, મોબાઈલ +૯૧ ૮૮૬૬૬૮૨૯૩७

શ્રી આચંગર પદ્માનાભન, મોબાઈલ નં. +૯૧ ૮૮૬૬૬૮૨૯૩૯

(૬) ઇચ્છુક બીકરોએ તેમની બીક રજુ કરતા પહેલા વેચાણના વિગતવાર નિચમો અને શરતો તેમજ પધ્ધતિ માટે વેબસાઈટ https://www.bank

eauctions.com ની મુલાકાત લેવી (७) મિલકતો રીઝર્વ કિંમતથી ઓછી કિંમતે વેચવામાં આવશે નહીં. (૮) મિલકત ૮ લોટમાં વેચાશે, જેની રિઝર્વ કિંમત લોટ પ્રમાણે ઉપર દશવિલી છે (૯)બીડરો સમગ્ર હરાજી દરમ્યાન બોલી વધારાની રકમ રૂા. ૧,૦૦,૦૦૦/- લોટ નં.૩ માટે, રૂા. ૨૫,૦૦૦/- લોટ નં. ૬ માટે અને રૂા. ૫,૦૦૦/-

બાર્કીના લિટસ(લીટ ને.૧,૨,૩,૪,૫,७ અને ૮) માટેના ગુણાંકમાં વધારી શકશે. (૧૦) મિલકતોનું જેમ છે જ્યાં છે ના ધોરણે અને ઇ-ઓક્શન એજન્સીની ઓફિસિચલ વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલા નિયમો અને શરતોને આધીન રહીને વેચાણ કરવામાં આવશે. (૧૧) સફળ બોલીકારે તેની ફાઈનલ બ્રીકની રકમના ૨૫% રકમ

ઇએમડીની સ્કમ એડજસ્ટ કર્યા બાદ તરત જ પછીના બેંકના કામકાજના દિવસો દરમ્યાન સાંજે ૪.૦૦ વાગ્યા સુધી માં ઉપરોક્ત દરાવિલ ખાતામાં RTGS/NEFT થી જમા કરાવવા. (૧૨) સફળ બોલીકારે હરાજીથી વેચાણ લેનાર બાકીના ७૫% વેચાણની સ્કમ પછી પંદર દિવસામાં ભરવી પડશે. જો પંદરમાં દિવસે રવિવાર કે અન્ય કોઈ

રજા હશે તો બેંકના પછીના કામકાજના દિવસે RTGS/NEFT દ્વારા ઉપર જણાવ્યા પ્રમાણે ભરવા પડશે. આ ઉપરાંત ખરીદનારે કુલ વેચાણ કિંમતની ૧% પોન્ડેજ ફી (પ્લસ રૂ!.૧૦/-) રજીસ્ટ્રાર ડીઆરટી-૧, અમદાવાદની તરફેશના ડીડી મારફતે ચૂકવવી પડશે. પોન્ડેજ ફી માટે તૈયાર કરોલો ડીડી-રિકવરી ઓફિસર, ડીઆરટી-૧,

અમદાવાદની ઓફિસમાં સીધો જમા કરાવવો. (૧૩) નિર્ધારીના અમયમાં પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળ જવાથી વેચાણના ખર્ચા બાદ કર્યા બાદ જે નીચે સહી કરનારને ચોગ્ય લાગે તે પ્રમાણે કાપીને બાકીના સરકારી ખાતામાં જમા કરશે. અને કસુરવાર ખરીદનારનો મિલકત કે જમા રકમ પર કોઈ દાવો રહેશે નહીં. અને ફરીથી વેચાણન જાહેરાત દ્વારા મિલકતનું ફરીથી વેચાણ થશે, તદુપરાંત ખરીદનારે આખરી પ્રસ્તાવની રકમ અને પથીથી વેચાયેલ રકમનો તફાવતના નાણાં પોતાની પાસેથી ભરવા પડશે.

46-08-5058

09-04-2028

09-04-2028

03-04-2028

(जोंधः विवाहना समये आ नोटिसनो अंग्रेज अनुवाह मान्य राजवामां आवशे)

મારા હસ્તક અને ટ્રિબ્યુનલના સિક્કા સાથે તા. ૧૯મી માર્ચ, ૨૦૨૪ ના રોજ આપવામાં આવી છે.

(૧૫) રીકવરી ઓફિસરને કોઇપણ કારણ આપ્યા વગર કોઈપણ બીડ સ્વીકારવાની કે નકારવાની અને વેચાણ મોકુફ રાખવાની અથવા કેન્સલ કરવાર્ન

•

રિકવરી ઓક્સિર-૨.

ડીઆરટી-૧, અમદાવાદ

